

# લિબર્ટી પેપરસેટ

ધોરણ 12 : રસાયણ વિજ્ઞાન

**Full Solution**

સમય : 3 કલાક

અસાઈનમેન્ટ પ્રશ્નપત્ર 4

Part A

1. (D) 2. (C) 3. (B) 4. (C) 5. (C) 6. (A) 7. (D) 8. (C) 9. (B) 10. (D) 11. (A) 12. (C) 13. (C) 14. (C) 15. (D) 16. (C) 17. (B) 18. (D) 19. (B) 20. (A) 21. (D) 22. (D) 23. (B) 24. (A) 25. (C) 26. (A) 27. (B) 28. (D) 29. (A) 30. (A) 31. (B) 32. (C) 33. (A) 34. (C) 35. (C) 36. (D) 37. (B) 38. (C) 39. (C) 40. (B) 41. (B) 42. (B) 43. (C) 44. (C) 45. (D) 46. (B) 47. (A) 48. (C) 49. (B) 50. (A)




## Part B

### વિભાગ A


➤ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો : (દરેક પ્રશ્નના 2 ગુણ)

1.

➤ (i) સુકોળના જળવિભાજનથી ગલુકોગ અને કુકટોગ મળે છે



➤ (ii) લેકટોગના જળવિભાજનથી B-D-ગોલેકટોગ અને B-D-ગલુકોગ મળે છે.




2.

➤ કાર્બોહાઇડ્રેટ સંયોજનોને ડિડ્યુસિંગ શર્કરા (ડિડક્ષનકર્તા શર્કરા) અથવા નોન-ડિડ્યુસિંગ શર્કરામાં (બિનાડિડક્ષનકર્તા શર્કરા) વર્ગીકૃત કરી શકાય છે.

➤ 'જે કાર્બોહાઇડ્રેટ સંયોજનો ફેલદિંગના દ્રાવણનું અને ટોલેન્સના પ્રક્રિયકર્તું ડિડક્ષન કરે છે, તેને ડિડ્યુસિંગ શર્કરા કહેવાય છે.' બધા મોનોસેક્રાઇડ સંયોજનો પછી તે આડોગ હોય કે, કિટોગ હોય તેઓ ડિડ્યુસિંગ શર્કરાએ છે.




3.

➤ ધાત્વીય ફ્લોરાઇડ સંયોજનો જેવાં કે,  $AgF$ ,  $Hg_2F_2$ ,  $CoF_2$  અથવા  $SbF_5$ ની હાજરીમાં આકાધાલ કલોરાઇડ / ખોમાઇદને ગરમ કરવાથી આકાધાલ ફ્લોરાઇડ સંયોજનનું સંઘેખણ ઉત્તમ રીતે પૂર્ણ કરી શકાય છે. આ પ્રક્રિયાને સ્વાર્ટસ્ક્રુ પ્રક્રિયા કહેવાય છે.



4.


➤ એલિફ્ટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનોને કલારોઝ્નેર્મ અને ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરતાં ખરાબ વાસ ધરાવતા આઈસોસાયનાઇડ અથવા કાર્બોહાઇલએમાઇન સંયોજનો બને છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો આ પ્રક્રિયા દર્શાવતા નથી. આ પ્રક્રિયાને કાર્બોહાઇલએમાઇન પ્રક્રિયા અથવા આઈસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ કસોટીનો ઉપયોગ પ્રાથમિક એમાઇનની પરખ માટે થાય છે.



ઉદા.,

5.

➤ ગ્રેલિયલ સંઘેખણ પ્રાથમિક એમાઇન સંયોજનોની બનાવટમાં ઉપયોગી થાય છે. પ્રેલિમાઇનની ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં પ્રેલિમાઇનનો પોટેશિયમ ક્ષાર મળે છે. જેને આકાધાલ હેલાઇડ સાથે ગરમ કરીને આકલાઇન જળવિભાજન કરતાં અનુવર્ત્તી પ્રાથમિક એમાઇન સંયોજન મળે છે. આ પદ્ધતિથી એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજનો બનાવી શકતાં નથી, કારણ કે એરાઇલ હેલાઇડ સંયોજનો પ્રેલિમાઇનથી બનનતા અખણાયન સાથે કેન્દ્રાનુરાગી વિસ્તારન પ્રક્રિયા કરતાં નથી.



6.

- “મિશ્ર ધાતુઓ એ જુદી જુદી ધાતુઓ અથવા ધાતુ અને અધાતુઓનું સમાંગ મિશ્રણ છે.”
- એક સુપરિશ્લ્ય મિશ્ર ધાતુ મિશ્ર ધાતુ એ લેન્થોનોઇડ ધાતુ (આશરે 95%) અને આયરન (આશરે 5%) અને અવ્યપ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેંદ્રીયમ અને એટ્યુમિનિયમ ધરાવે છે. મિશ્ર ધાતુનો મોટો જથ્થો મેળેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવા થાય છે, જેને બંદ્કુની ગોળી, કવચ અને લાઇટરમાં ચકમક માટેના પથ્થર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

7.

$$\log \frac{k_2}{k_1} = \frac{E_a}{2.303 R} \left[ \frac{T_2 - T_1}{T_1 T_2} \right]$$

$$\log \frac{0.07}{0.02} = \left( \frac{E_a}{2.303 \times 8.314 \text{ JK}^{-1} \text{ mol}^{-1}} \right) \left[ \frac{700 - 500}{500 \times 700} \right]$$

$$0.544 = E_a \times 5.714 \times 10^{-4} / 19.15$$

$$E_a = 0.544 \times 19.15 / 5.714 \times 10^{-4}$$

$$= 18230.8 \text{ J}$$

Aની ગાણતરી માટે

આર્ટેનીયસ સમીકરણ અનુસાર

$$\log K = \log A - \frac{E_a}{2.303 RT}$$

$$\therefore \log (0.02) = \log A - \frac{18230.8}{2.303 \times 8.314 \times 500}$$

$$\therefore -1.6982 = \log A - 1.9042$$

$$\therefore \log A = -1.6982 + 1.9042$$

$$\therefore \log A = 0.206$$


$$\therefore A = \text{Antilog} (0.206)$$

$$= 1.6069$$


$$A \approx 1.61$$

8.

- ભૌમિતિક સમઘટકો :




- પ્રકાશીય સમઘટકો :




9.

→ બેન્જીનમાંથી 4-બ્રોમોનાઇડ્રોબેન્જીન :




10.

→ ગ્રુકોગના એસિટિક અનેનહાઇડ્રાઇડ સાથેના એક્સિટિલેશનથી ગ્રુકોગ પેન્ટાએસિટેટ જને છે, જે પાંચ -OH સમૂહોની જુદા જુદા કાર્બન પરમાળું સાથે જોડાવેલા હોવા જોઈએ.



→  $HNO_3$  સાથેની પ્રક્રિયા :

ગ્રુકોગ અને ગ્રુકોનિક એસિડ બંને નાઇટ્રિક એસિડ દ્વારા ઓક્સિડેશન પામીને એક ડાયકાર્బોક્સિલિક એસિડ- રોકેરિક એસિડ બનાવે છે. આ બાબત ગ્રુકોગમાં પ્રાથમિક આલ્કોહોલ (-OH) સમૂહની હાજરી રૂચાવે છે.




11.

→ સંક્રાંતિ ધાતુઓ (Zn, Cd અને Hgના અપવાણ સહિત) અત્યંત કઠણ હોય છે અને નીરી બાધશીલતા ધરાવે છે. તેમના ગલનબિંદુ અને ઉટકલનબિંદુ ભીચા હોય છે. તેમના ઊંચા ગલનબિંદુનું કારણ અંતરપરમાણીય ધાત્વીય બંધમાં ns ઇલેક્ટ્રોન ઉપરોંત (n-1)d કક્ષકોના વધુ ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. Mn અને Tcના અપવાણને બાદ કરતાં દરેક હોળમાં આ ધાતુઓના ગલનબિંદુ d<sup>5</sup> ઇલેક્ટ્રોનીય રૂચના પર મહત્વમાં હોય છે અને પરમાણીયકર્માંક વધવાની સાથે ગલનબિંદુ નિયમિત રીતે ઘટે છે. તેઓ પરમાણીયકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે. દરેક શ્રેણીની લગભગ મધ્યમાં રહેલ તત્ત્વની મલ્યોક d-કક્ષક્રમાં રહેલો એક અચુક્યિત ઇલેક્ટ્રોન અંતરપરમાણીય પારસ્પરિક કિયા માટે અનુકૂળ બનતો હોવાથી તેઓ ઊંચી પરમાણીયકરણ એન્થાલ્પી દરશાવે છે.

→ સામાન્ય રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હોય તેટલું પ્રભળ ધાત્વીય બંધન થશે, આથી ધારી ઊંચી પરમાણીયકરણ એન્થાલ્પી અથર્થાત ધણા ભીચા ઉટકલનબિંદુલાણી ધાતુઓ પ્રક્રિયા દરમિયાન નિર્ધિય રહેવાનું વલણ દરશાવે છે.

→ દ્વિતીય અને તૃતીય શ્રેણીની ધાતુઓની પરમાણીયકરણ એન્થાલ્પીનાં મૂલ્યો પ્રથમ શ્રેણીનાં અનુવર્ત્તી તત્ત્વો કરતાં વધુ હોય છે.



12.

- અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેનના ઈલેક્ટ્રોન અને ધાતુની d-કક્ષકોના ઈલેક્ટ્રોન વચ્ચે અપાકર્ણથાં d-કક્ષકોનું સમશક્તિપાણું દૂર થશે, જેને પરિણામે એણ કક્ષકો નીચી ઊર્જાના  $t_{2g}$  માં ગોઠવાશે અને બે કક્ષકો ઊંચી ઊર્જાના  $e_g$  માં ગોઠવાય છે, ઊર્જાના આ તફાવતને સ્ફટિકક્ષેત્ર વિપાઠન ઊર્જા કહે છે.
- તેને  $\Delta_0$  વડે દર્શાવાય છે.
- $\Delta_0$ ની માત્રા સવર્ગ સ્પેસીગ્રમમાં d-કક્ષકોની વાસ્તવિક રચના નક્કી કરે છે, જે નીચે મુજબ સમજાવી શકાય.

(i) જો  $\Delta_0 < P$  હોય, તો ચોથો ઈલેક્ટ્રોન  $e_g$  કક્ષકમાં ગોઠવાશે અને  $t_{2g}^3 e_g^1$  સંરચના આપશે. નિર્જળ ક્ષેત્ર ઉત્પન્ન કરતાં લિગેન માટે  $\Delta_0 < P$  હોય છે, જે ઉચ્ચ ભરમણ સંકીર્ણ બનાવે છે.


(ii) જો  $\Delta_0 > P$  હોય, તો ચોથો ઈલેક્ટ્રોન  $t_{2g}$  કક્ષકમાં ગોઠવાશે અને  $t_{2g}^4 e_g^0$  સંરચના આપશે. પ્રભળ ક્ષેત્ર ઉત્પન્ન કરતાં લિગેન માટે  $\Delta_0 > P$  હોય છે, જે નિમ્ન ભરમણ સંકીર્ણ બનાવે છે.

### વિભાગ B



- નીચે આપેલા પ્રશ્નોના માંગયા મુજબ ઉત્તર આપો : (દરેક પ્રશ્નના 3 ગુણ)

13.


- જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ સીધો જોડાયેલો હોય તેને  $\beta$ -કાર્બન પરમાણુ કહે છે અને આ કાર્બનની પાસેના કાર્બનને  $\beta$ -કાર્બન કહે છે.
- “જ્યારે  $\beta$ -હાઇડ્રોજનયુક્ત હેલોઓલ્ડેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીય દ્વારા સાથે ગરમ કરવામાં આવે તો  $\beta$ -કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુનું અને  $\alpha$ -કાર્બન પરમાણુ પરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય છે.”



- B = બેઝ, X = અવશિષ્ટ સમૂહ
- પરિણામે નીપણ તરીકે એક આલ્કીન સંયોજન બને છે.
- નોકે, આ વિલોપનમાં  $\beta$ -હાઇડ્રોજન પરમાણુ સંકળાયેલા હોવાથી તેને સામાન્ય રીતે  $\beta$ -વિલોપન પણ કહે છે.



- જ્યારે એક કરતાં વધુ  $\beta$ -હાઇડ્રોજન પરમાણુનો માંથી હોવાના કારણે એક કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવના હોય ત્યારે સામાન્ય રીતે એક આલ્કીન મુખ્ય નીપણ તરીકે બને છે, જે સૌપ્રથમ રચિયાન રસાયણવિજ્ઞાની એલેક્ટ્રોનિક જેટસેવે (જેનું જેલોફ્થી પણ ઉત્પારણ થાય છે) નોંધી. તેમણે 1875માં એક નિયમ પ્રસ્તાવિત કર્યો, “ડિહાઇડ્રોહેલોજનિકરણ પ્રક્રિયામાં મુખ્ય નીપણ તરીકે એવો આલ્કીન મળે છે કે, જેમાં ડ્રિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કોઇલ સમૂહો જોડાયેલા હોય.”
- આમ, 2-ગ્રોમેપેન્ટન મુખ્ય નીપણ તરીકે પેન્ટ-2-ઇન આપે છે.



પેન્ટ-2-ઇન (81%)

2-ગ્રોમેપેન્ટન

પેન્ટ-1-ઇન (19%)

14.

- છેટેનનું આધીયદળ =  $100 \text{ g mol}^{-1}$
- ઓક્ટેનનું આધીયદળ =  $114 \text{ g mol}^{-1}$
- છેટેનના મોલ =  $\frac{26}{100} = 0.26 \text{ mol}$
- ઓક્ટેનના મોલ =  $\frac{35}{114} = 0.307 \text{ mol}$
- કુલ મોલ =  $0.567 \text{ mol}$
- છેટેનના મોલ અંશ  $X_A = \frac{0.26}{0.567} = 0.458$
- ઓક્ટેનના મોલ અંશ  $X_B = 1 - 0.458 = 0.541$
- $p_{\text{સ્થાન}} = p_A^0 \cdot X_A + p_B^0 \cdot X_B$   
 $= 105.2 \times 0.458 + 46.8 \times 0.541$   
 $= 48.20 + 25.30 = 73.5 \text{ Kpa}$

15.

- ધારો કે,  $R \rightarrow P$  શૂન્યકુમની પ્રક્રિયા છે.

આ પ્રક્રિયા માટે વેગ નિયમની રજૂઆત નીચે મુજબ કરી શકાય.

$$\text{વેગ} = - \frac{d[R]}{dt} = k[R]^0$$

$$\text{વેગ} = - \frac{d[R]}{dt} = k$$

આમ, શૂન્યકુમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદર્ભાધી સ્વતંત્ર હોય છે.

$$d[R] = -k dt$$

બંને બાજુ સંકલન કરતાં

$$[R] = -k t + I \dots\dots\dots \text{સમીકરણ (1)}$$

જ્યાં I સંકલન અચળાંક છે.

- ધારો કે,  $t = 0$  સમયે પ્રક્રિયક Rની સાંદર્તા (તેની પ્રારંભિક સાંદર્તા) =  $[R]_0$  છે, આ મૂલ્યો સમીકરણ (1) માં મૂકતાં

$$[R]_0 = -k \times 0 + I$$

$$[R]_0 = I$$


$I$ નું મૂલ્ય સમીકરણ (1)માં દાખલ કરતાં

$$[R] = -k t + [R]_0 \dots\dots\dots \text{સમીકરણ (2)}$$

સમીકરણ (2)નું સરળીકરણ કરતાં

$$k = \frac{[R]_0 - [R]}{t}$$

સમીકરણ (2)ને સીધી રેખાના સમીકરણ  $y = mx + c$  સાથે સરખાવીએ અને  $[R]$  (સાંદર્તા)નો  $t$  (સમય) વિટુલ્ય આલેખ દોરીએ તો આપણાને સીધી રેખા મળશે.



જેના ટાળ =  $-k$  અને અંતરછેદ બરાબર  $[R]_0$  થશે.

16.

- કેન્દ્રીય વિદ્ધોટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે.

$$t_{1/2} = 28.1 \text{ વર્ષ}, [R]_0 = 1 \text{ }\mu\text{g}$$

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,

$$k = \frac{0.693}{t_{1/2}} = \frac{0.693}{28.1}$$

$$= 2.466 \times 10^{-2} \text{ }\mu\text{g}^{-1}$$

- 10 વર્ષ પછી બાકી રહેલ  $^{90}\text{Sr}$  ની ગણતરી :

$$t = \frac{2.303}{k} \log \frac{[R]_0}{[R]_t}$$

$$\therefore \log \frac{[R]_0}{[R]_t} = \frac{t \times k}{2.303} = \frac{10 \times 2.466 \times 10^{-2}}{2.303}$$

$$\therefore \log \frac{1}{[R]_t} = 0.1070$$

$$\therefore \frac{1}{[R]_t} = \text{Antilog of } 0.1070 = 1.2794$$

$$\therefore [R]_t = \frac{1}{1.2794} = 0.7816 \mu\text{g} \text{ }^{90}\text{Sr} \text{ બાકી રહેલ છે.}$$

- 60 વર્ષ પછી બાકી રહેલ  $^{90}\text{Sr}$  ની ગણતરી :

$$t = \frac{2.303}{k} \log \frac{[R]_0}{[R]_t}$$

$$\therefore \log \frac{[R]_0}{[R]_t} = \frac{t \times k}{2.303} = \frac{60 \times 2.466 \times 10^{-2}}{2.303}$$

$$\therefore \log \frac{1}{[R]_t} = 0.6425$$


$$\therefore \frac{1}{[R]_t} = \text{Antilog of } (0.6425) = 4.39$$

$$\therefore [R]_t = \frac{1}{4.39}$$

$$= 0.228 \mu\text{g} \text{ }^{90}\text{Sr} \text{ બાકી રહેલ છે.}$$


17.

- લેન્થેનોઇડસના શરખાતના સભ્યો કેન્દ્રીયમ જેટલાં પ્રતિક્રિયાત્મક હોય છે, પરંતુ પરમાણુકમાંકના વધારા સાથે તેમની પ્રતિક્રિયાત્મકતા અન્યુભિનિયમ જેટલી થાય છે.
- જ્યારે ધાતુઓને હાઇડ્રોજન વાયુ સાથે દીમેથી ગરમ કરવામાં આવે છે ત્યારે ધાતુઓ હાઇડ્રોજન સાથે સંયોજાય છે.
- ધાતુઓને કાર્બન સાથે ગરમ કરતાં કાર્બાઇડ સંયોજનો  $\text{Ln}_3\text{C}$ ,  $\text{Ln}_2\text{C}_3$  અને  $\text{LnC}_2$  બને છે.
- તેઓ મંદ એસિડ સંયોજનોમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને ફેલોજન સંયોજન સાથે બળીને ફેલાઇડ સંયોજનો બનાવે છે. તેઓ  $\text{M}_2\text{O}_3$  ઓક્સાઇડ સંયોજનો અને  $\text{M(OH)}_3$  હાઇડ્રોક્સાઇડ સંયોજનો બનાવે છે.
- એક્ટિનોઇડસ અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે, ખાસ કરીને જ્યારે તેઓ સૂક્ષ્મ વિભાગિત હોય ત્યારે.
- ઉદાહરણ તરીકે, ડિકાળા પાણીની તેમની સાથેની પ્રક્રિયા ઓક્સાઇડ અને હાઇડ્રોઇડનું મિશ્રણ આપે છે અને મદ્યમ તાપમાને તેઓ મોટા ભાગની અધાતુઓ સાથે સંયોજાય છે.
- હાઇડ્રોક્લોરિક એસિડ બધી ધાતુઓ પર હુમલો કરે છે, પરંતુ મોટા ભાગની ધાતુઓ નાઈટ્રિક એસિડથી ઓછી અસર પામે છે, કારણ કે આ ધાતુઓ પર ઓક્સાઇડનું સંરક્ષિત સ્તર બને છે; આક્ઝલીની આ ધાતુઓ પર કોઈ અસર થતી નથી.
- ઓછી આચાનકારણ એન્થાલ્પી અને મોટા કદને કારણે લેન્થેનોઇડસ કરતાં એક્ટિનોઇડસ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે.




18.




- એનિલિનનું સીંધું નાઇટ્રોશન નાઇટ્રો વ્યુત્પણો ઉપરાંત કોલટારી (ડામરી) અંગ્ઝિસ્ટેક્શન નીપજો આપે છે. વધુમાં પબળ એસિટિક માધ્યમમાં એનિલિન પ્રોટોનિત થઈને એનિલિનિયમ આચન બનાવે છે, જે મેટાનિદ્દશક હોય છે. તેથી ઓર્થો અને પેરા વ્યુત્પણ સિવાય મેટા વ્યુત્પણ પણ અર્થસ્થૂક પ્રમાણમાં બને છે.





- જો કે એસિટિક એનાઇટ્રોધાદ વડે એસિટિલેશન પ્રક્રિયા દ્વારા -NH<sub>2</sub> સમૂહને સંરક્ષિત કરી નાઇટ્રોશન પ્રક્રિયાને નિયંત્રિત કરી શકાય છે અને p-નાઇટ્રો વ્યુત્પણને મુખ્ય નીપજ તરીકે મેળવી શકાય છે.





19.




- એસિડ ઉદ્ઘાપકીય જલીયકરણ દ્વારા : આલ્કીન સંયોજનો એસિડ ઉદ્ઘાપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલ સંયોજનો બનાવે છે. અસમભિત આલ્કીન સંયોજનોના કિરણામાં યોગશીલ પ્રક્રિયા માર્કોવનિકોવના નિયમ મુજબ થાય છે.




- ક્રિયાવિધિ :
- આ પ્રક્રિયાની ક્રિયાવિધિમાં નીચે દર્શાવેલ અણા તબક્કાઓ સમાવેલા છે.
- તબક્કો-1 :  $\text{H}_3\text{O}^+$  ના ઇલેક્ટ્રોલ અનુરાગી હુમલા દ્વારા આટ્કીનના પોટોનેશનથી કાર્બોક્સિટાયન બને છે.



- તબક્કો-2 : કાર્બોક્સિટાયન પર પાણીનો કેન્દ્રાનુરાગી હુમલો




- તબક્કો-3 : વિપ્રોટોનિકરણથી (deprotonation) આઝોહોલ બને છે.



21.

- ડનિયલકોષમાં નીચે મુજબ પ્રક્રિયા થાય.



- જેમ સમય પસાર થાય છે તેમ જે  $\text{Zn}^{2+}$  આયનની સાંદ્રતા વધતી જાય છે અને  $\text{Cu}^{2+}$  આયનની સાંદ્રતા ઘટતી જાય છે.
- આ જ સમયે વોલ્ટમીટર પર કોષનો વોલ્ટેજ ઘટતો જાય છે.
- કેટલાક સમય પછી આપણે નોંધી શકીએ છીએ કે,  $\text{Cu}^{2+}$  અને  $\text{Zn}^{2+}$  આયનની સાંદ્રતામાં ફેરફાર થતો નથી અને એ જ સમયે વોલ્ટમીટર શૂન્ય વાંચન દર્શાવે છે. આ સૂચયે છે કે, સંતુલન પ્રાપ્ત થઈ ગયેલ છે.
- સંતુલન સમયે  $E_{cell} = 0.0V$  થાય અને  $n = 2$  હોવાથી ડનિયલકોષ માટે નન્દર્દી સમીકરણ નીચે મુજબ લખી શકાય.

$$E_{(cell)} = 0 = E_{(cell)}^\theta - \frac{2.303RT}{2F} \log \frac{[\text{Zn}^{2+}]}{[\text{Cu}^{2+}]}$$

અથવા

$$E_{(cell)}^\theta = \frac{2.303RT}{2F} \log \frac{[\text{Zn}^{2+}]}{[\text{Cu}^{2+}]}$$

- પર્યાય સંતુલને ઉપરોક્ત પ્રક્રિયા માટે,

$$\frac{[\text{Zn}^{2+}]}{[\text{Cu}^{2+}]} = K_c \text{ થશે.}$$

- અને  $T = 298 \text{ K}$  તાપમાને ઉપરનું સમીકરણ આ પ્રમાણે લખી શકાય.

$$E_{(cell)}^\theta = \frac{0.059V}{2} \log K_C = 1.1V \quad (E_{(cell)}^\theta = 1.1V)$$

$$\log K_C = \frac{(1.1V \times 2)}{0.059V} = 37.288$$

$$298 \text{ K તાપમાને } K_C = 2 \cdot 10^{37}$$

➤ નીચે આપેલા પ્રશ્નોના માટ્યા મુજબ ઉત્તર આપો : (દરેક પ્રશ્નના જ ગુણ)

22.

$$\rightarrow \text{એસિટિક એસિડના મોલની સંખ્યા} = \frac{0.6 \text{ mL} \times 1.06 \text{ g mL}^{-1}}{60 \text{ g mol}^{-1}} \\ = 0.0106 \text{ mol}$$

$$\rightarrow \text{મોલાલિટી} = \frac{0.0106 \text{ mol}}{1000 \text{ mL} \times 1 \text{ g mL}^{-1}} \\ = 0.0106 \times 10^{-3} \text{ mol g}^{-1} \\ = 0.0106 \text{ mol kg}^{-1}$$

$$\rightarrow \Delta T_f = K_f m$$

$$\rightarrow \Delta T_f = 1.86 \text{ K kg mol}^{-1} \times 0.0106 \text{ mol kg} \\ = 0.0197 \text{ K}$$

$$\rightarrow \text{વોન્ટ હોફ અવચ્ચ (i)} = \frac{\text{અવલોકિત કારાંબિંડ}}{\text{ગાણતરી કરેલ કારાંબિંડ}} \\ = \frac{0.0205 \text{ K}}{0.0197 \text{ K}} = 1.041$$

$$\alpha = \frac{i - 1}{n - 1}, \text{ જ્યાં } n = 2 \\ = \frac{1.041 - 1}{2 - 1} = 0.041$$

→ નિર્ધાર એસિડનો વિયોજન અચળાંક


$$\rightarrow K_a = \frac{C \alpha^2}{1 - \alpha} \\ \therefore K_a = \frac{0.0106 \times 0.041^2}{1 - 0.041}$$

$$\therefore K_a = \frac{1.78 \times 10^{-5}}{0.959} \\ \therefore K_a = 1.86 \times 10^{-5}$$

23.

$$\rightarrow W = 1.45 \text{ g}, I = 1.5 \text{ Amp}, t = ?$$

$$M = 108 \text{ g mol}^{-1}, Z_1 = 1$$



$$W = \frac{ItM}{Z_1 F}$$

$$\therefore t = \frac{WZ_1 F}{IM}$$

$$= \frac{1.45 \times 1 \times 96500}{1.5 \times 108}$$

$$= 863.7 \text{ Sec.}$$

$$\therefore t = 863.7 \text{ Sec.} = 14 \text{ મિનિટ } 23 \text{ સેકન્ડ}$$

$$\frac{W_{Ag}}{E_{Ag}} = \frac{W_{Zn}}{E_{Zn}} \quad \therefore \frac{1.45}{\frac{108}{1}} = \frac{W_{Zn}}{\frac{65.3}{2}}$$

$$\therefore W_{Zn} = \frac{1.45 \times 65.3}{108 \times 2} = 0.438 \text{ g}$$

$$\text{જમા થતી } Zn^{+2} \text{ દરેક } = 0.438 \text{ g}$$



$$\frac{W_{Ag}}{E_{Ag}} = \frac{W_{Cu}}{E_{Cu}} \quad \therefore \frac{1.45}{\frac{108}{2}} = \frac{W_{Cu}}{\frac{63.5}{2}}$$

$$\therefore W_{Cu} = \frac{1.45 \times 63.5}{108 \times 2} = 0.426 \text{ g}$$



જમા થતો Cuનું વજન = 0.426 g

24.


→ (a) સ્ફૂર્ત કોપ





→ (b) લેડ સંગ્રહક બેટરી



→ (c) બળતા કોપ



→ (d) લોખાડનું કારણ :



25.


→ (a) પ્રોપેનાલ અને પ્રોપેનોન આયોડોફોર્મ કસોટી દ્વારા વિભેદિત કરી શકાય.




આયોડોફોર્મ

આ કસોટી  $-\text{COCH}_3$  સમૂહ દ્વારાવાત્તા આઇલાઈડ સંયોજનો આપે છે, પ્રોપેનાલમાં  $-\text{COCH}_3$  સમૂહ નાહીં હોવાથી તે આયોડોફોર્મ કસોટી આપશે નાહીં

→ આલોલ સંઘનન : “જે આઇલાઈડ અને કીટોન સંયોજનોમાં ઓછામાં ઓછા એક  $\alpha$ -હાઇડ્રોજન હોય છે તે મંદ બેંગુની ઉદ્દીપક તરીકેની હાજરીમાં પ્રક્રિયા કરી અનુકૂળ ભેંડાઇડ્રોક્લિસ આઇલાઈડ (આલોલ) સંયોજનો અથવા  $\beta$ -હાઇડ્રોક્લિસ કીટોન (કીટોલ) સંયોજનો બનાવે છે. આ પ્રક્રિયાને આલોલ પ્રક્રિયા કહું છે.”



બ્યુટ-2-ઈનાલ  
(આલોલ સંઘનન નીપણ)



4-મિથાઈલપેન્ટ-3-ઈન-2-ઓન  
(આલોલ સંઘનન નીપણ)

→ આલોલ નામ નીપણેમાં રહેલા બે ક્રિયાશીલ સમૂહો આઇલાઈડ અને આલોહોલના નામ પરથી પડતું છે. આલોલ અને કીટોલ સંયોજનો પાણીનો અણુ સરળતાથી ગુમાવીને  $\alpha$ ,  $\beta$ -અસ્ટેન્પ્લાટ કાર્બોનિલ સંયોજનો બનાવે છે, જે આલોલ સંઘનન નીપણો છે અને આ પ્રક્રિયાને આલોલ સંઘનન કહેવાય છે. કીટોન સંયોજનો કીટોલ સંયોજનો બનાવે છે (કીટોન અને આલોહોલ સમૂહ દ્વારાવાત્તા સંયોજનો), તેમ છતાં તેમની આઇલાઈડ સંયોજનો સાથે સામ્યતા હોવાના કારણે કીટોન સંયોજનોની આ પ્રક્રિયા માટે પણ સામાન્ય નામ આલોલ સંઘનન જ વપરાય છે.



(a)

- (i) પોટેશિયમ ટ્રાયઅ૱ન્ડેટોકોમેટ (III)
- (ii)  $[\text{Co}(\text{NH}_3)_4(\text{H}_2\text{O})\text{Cl}]\text{Cl}_2$

(b)  $[\text{Cr}(\text{NH}_3)_6]^{+3}$  માં Cr ની ઓક્સિડેશન અવસ્થા +3 છે.

Cr<sup>+3</sup> ની ઈલેક્ટ્રોન રથના : [Ar] 3d<sup>3</sup>4s<sup>0</sup> છે.

Cr<sup>+3</sup> ધાતુ આયન કક્ષકોમાં d<sup>2</sup>sp<sup>3</sup> સંકરણ થાય છે.



ઈલેક્ટ્રોનયુગમ આપે છે.


$[\text{Cr}(\text{NH}_3)_6]^{+3}$  સંકીર્ણમાં અણ અચુંભકીય છે.

$[\text{Ni}(\text{CN})_4]^{-2}$  :

$[\text{Ni}(\text{CN})_4]^{-2}$  સંકીર્ણમાં દેણી સોક્સિડેશન અવસ્થા +2 છે.

Ni<sup>+2</sup> ની ઈલેક્ટ્રોનરથના : [Ar] 3d<sup>8</sup>4s<sup>0</sup>.

Ni<sup>+2</sup> ધાતુ આયનની કક્ષકોમાં dsp<sup>2</sup> સંકરણ થાય છે, કારણકે CN<sup>-</sup> મળા લિગેન હોવાથી d-કક્ષકમાં ઈલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે.



$[\text{Ni}(\text{CN})_4]^{-2}$  :




ઈલેક્ટ્રોનયુગમ આપે છે.


$[\text{Ni}(\text{CN})_4]^{-2}$  સંકીર્ણમાં બધાં જ ચુંભિત ઈલેક્ટ્રોન હોવાથી તે મતિયુંભકીય છે.

27.


→ આ સમભિતિય અને અસમભિતિય ઇથર સંઘોજનોની બનાવટ માટેની અગત્યની પ્રયોગશાળા પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંઘોજનોની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.



→ આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સુમહૂર્ત (દ્વિતીયક અથવા તૃતીયક) ધરાવતાં ઇથર સંઘોજનો પણ બનાવી શકાય છે. આ  $\text{S}_{\text{N}}2$  પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પર આલ્કોક્સાઇડ આયનનો હુમલો થાય છે.



→ જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય, તો ઉત્તમ પરિણામ મળે છે. દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સંઘોજનોના કિરસામાં વિલોપનપ્રક્રિયા, વિસ્થાપનપ્રક્રિયા સાથે સ્પર્ધા કરે છે. જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ કરવામાં આવે, તો પ્રક્રિયા નીપણ તરીકે માત્ર આલ્કોન મળે છે અને ઇથર બનતો નથી. દા.ત.,  $\text{CH}_3\text{ONa}$ ની  $(\text{CH}_3)_3\text{C}-\text{Br}$  સાથેની પ્રક્રિયા માત્ર 2-મિથાઇલપ્રોપિન આપે છે.



→ આમ થવાનું કારણ એ છે કે, આલ્કોક્સાઇડ માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ નથી, પરંતુ મળા બેદજ પણ છે. તેઓ આલ્કાઇલ હેલાઇડ સંઘોજનો સાથે વિલોપનપ્રક્રિયા કરે છે.

- આ પદ્ધતિથી ફિનોલ સંયોજનો પણ ઇથર સંયોજનોમાં રૂપાંતર પામે છે. આમાં ફિનોલ, ફિનોક્સાઇડ અર્દ્ભાગ (moiety) તરીકે ઉપયોગી થાય છે.

